



सत्यमेव जयते

MALIYA MIYANA NAGARPALIKA

Notice Inviting On-line Tender

Details about Tender:

Department Name	MALIYA MIYANA NAGAR PALIKA, MALIYA MIYANA
Circle/Division	MALIYA MIYANA NAGAR PALIKA, MALIYA MIYANA
IFB No / Tender Notice No.	2026-2027
Name of Project	વિદેકાધીન ગ્રાન્ટ વર્ક ૨૦૨૬-૨૦૨૭
Name of Work	Supplying & Erecting Street Light Pole From Different Location For Maliya Miyana Nagarpalika.
Estimated Contract Value (INR)	Rs. 12,58,343.00
Period Of Completion(in Months)	-
Bidding Type	Open
Bid Call (Nos)	1
Tender Currency Type	Single
Tender Currency Settings	Indian Rupee (INR)
Joint Venture	Not Applicable
Rebate	Not Applicable

Amount Details

Bid Document Fee :	Rs.900.00/- In form of Demand Draft Only
Bid Document Fee Payable To :	Chief Officer , Maliya Miyana Nagar Palika, Maliya Miyana
Bid Security/EMD (INR) :	Rs. 12,500.00./- Only Nationalized Bank will be accepted. (Exemption Certificate Not Allowed)
Bid Security/EMD In Favour Of :	Chief Officer Maliya Miyana Nagar Palika, Maliya Miyana
Total Security Deposit	<ol style="list-style-type: none">1. Total 10 % of Estimated Cost.2. 5% of Estimated Cost in form of FDR issued by Nationalized Bank and 5% deduct from Running Bill (As Per Government Rules.)

Bid Document Downloading Start Date	Automatic System Generated
Bid Document Downloading End Date	As per Online NIT
Pre Bid Meeting	N.A.
Last date of submission of Price bid	As per Online NIT
Bid Validity Period	120 Days, from price-bid opening date.
Remarks	<ol style="list-style-type: none">1. Price Bid is to be fill up online.2. Contractor shall have to deposit Tender fee in form of DD

	<p>and EMD in form of FDR issued by Nationalized Bank Only.</p> <p>3. The scanned copy of Certificate will have to be uploaded with all necessary documents and also to be submitted in hard copy at Nagar Palika along with Physical Submission.</p> <p>4. Submission of original EMD, Tender Fee, registration copy & Other Document during office hours up to As per Online NIT at MALIYA MIYANA Nagar Palika, MALIYA MIYANA upto Office Hours by R.P.AD Only in Sealed Cover Only.</p>
Bid Opening Date	As per Online NIT

Other Details

Officer Inviting Bids :	Chief Officer Maliya Miyana Nagar Palika
Bid Opening Authority :	Chief Officer Maliya Miyana Nagar Palika
Address :	Maliya Miyana Nagar Palika, Maliya Miyana
Contact Details :	Phone:

General Terms & Conditions:-

1.	The general Terms & Conditions are as per Tender Documents
2.	The cost of the Tender Document (Tender Fee) will not be refunded under any circumstances.
3.	The offer shall be valid for 120 days from the date of opening of the bid.
4.	Tenderers without tender document fee, EMD and which do not fulfill all any of the condition or submitted incomplete in any respect will be rejected.
5.	Bidder can apply as individual only not more than one tender for single work shall be submitted by bidder.
6.	Conditional tender will be rejected.
7.	MALIYA MIYANA Nagarpalika reserves the right to accept lowest responsive offer based on evaluation of package or reject any or all tenders without giving any reasons.
8.	The tenderers are advised to read carefully the instructions and Eligibly Criteria.
9.	The internet site address for E-tender is tender.nprocure.com
10.	<p>Bidders can avail the benefit of training in participation in online tender on any day in the office of M/s. (n) Code Solution - A Division of GNFC Ltd., at the address mentioned below.</p> <p>MIs. (n)Code Solution- A Division of GNFC Ltd. 301, GNFC Info Tower, Bodakdev, S.G.Road, Ahmadabad, Gujarat-380 054 INDIA Phone No. 079 26857316, 26857317, 26857318. Fax: 073 26857321</p>
11.	Bidders who wish to participate in this E-tender will have to procure valid digital certificate as per information technology act 2000.

12.	Bidders shall upload the tender documents, tender fee and EMD and other supporting documents in electric form on the website.
13.	The tender documents for these work are available only in electronic format which bidder can download from website free of cost.
14.	Bidder shall submit their offer in Electronic format on above mentioned website on or before the scheduled date and time as mentioned after Digitally Signing the same. No offer in the physical form will be accepted and any such offer will received at MALIYA MIYANA Nagar Palika bidder wil be disqualified from the tender.
15.	The technical Bid will be opened on the specified date online on website tender.nprocure.com Bidders or their representative who wish to participate it online tender opening can log on to above website on the due date and time mark their presence and participate in online tender opening. Bidders who wish to remain present at MALIYA MIYANA Nagar Palika premise at the time of tender opening can do so. Only one representative of each firm will be allowed.
16.	Bidders who wish to participate in online tender have to register with the website through the “New User Registration” link provided on the home page. Bidder will create login id & password on their own in registration process.
17.	Bidder who wish to participate in e-tender need to fill data in predefined forms of tender fee, EMD, experience details and Price Bid only.
18.	After filling data in predefined forms bidders need to click on final submission link to submit their encrypted bid.
19.	Bidder also have scan all documents without fail.
20.	FDR for EMD & DD for Tender fee shall be submitted in electronic format only through online (by scanning) while uploading the bid. This submission shall mean that EMD & Tender fee are received for purpose of opening the Bid. Accordingly offer of those shall be opened whose EMD & Tender Fee is received electronically, however for the purpose of realization of DD & FDR bidder shall send the DD & FDR in original through RPAD so as to reach to concerned office as mentioned in the tender document upto As per Online NIT. For not submitting DD & FDR in original bidder shall be banned to participate in any tender of the MALIYA MIYANA Nagar Palika for period of 3 years as a penalties action.

Contractor Signature

Chief Officer
Maliya Miyana Nagar Palika,
Maliya Miyana .

માળીયા મિયાણા નગરપાલિકા

અગત્યની શરતો

૧. પરત આવેલ ઈ-ટેન્ડરો પૈકી કોઈપણ ટેન્ડર કોઈપણ કારણસર આપ્યા સિવાય સ્વીકારવું, રદ કરવું, કોને આપવું અનેકયા ભાવથી આપવું તેમજ મંજૂર કે નામંજૂર કરવાની સત્તા નગરપાલિકાને આબાધીતરહેશે.
૨. શરતી ટેન્ડર સ્વીકારવામાં આવશે નહીં.
૩. ટેન્ડર સાથે ડીપોઝીટની રકમ એફ.ડી.આર. થી મોકલવાની રહેશે અર્નેસ્ટમની ડીપોઝીટની રકમ વગરના ટેન્ડર માન્ય ગણાશે નહીં.
૪. કામ મંજૂર થયા પછી સરકારશ્રીના નિયમો અનુસાર બિલ માંથી કપાત કરવામાં આવશે તથા વખતો વખત જે નિયમો આવશે તે મુજબ કપાત થતા રહેશે.
૫. ચાલુ કામે તકરાર યા મતભેદ પડશે તો ટેન્ડર મંજૂર કરનાર ઓર્થોરીટી જે નિર્ણય લેશે તે નિર્ણય કોન્ટ્રાક્ટર/એજન્સીને આખરી અને બંધનકર્તા રહેશે તેમાં કોઈ દાદ કે ફરીયાદ ચાલશે નહીં.
૬. ટેન્ડર મંજૂર થયેથી સરકારી નિયમ મુજબના ઈન્કમેટેક્સ તથા અન્ય ચાર્જ બિલમાંથી કપાત કરવામાં આવશે.
૭. ટેન્ડર મંજૂર થયેથી સરકારી નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યૂટીનો સ્ટેમ્પ તેમજ એગ્રીમેન્ટ માટેનો નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ કોન્ટ્રાક્ટર/એજન્સીએ રજુ કરવાનો રહેશે.
૮. ટેન્ડરના ભાવમાં કોઈ ભાવ વધારો કે ભાવ ફેર કરી આપવામાં આવશે નહીં.
૯. ટેન્ડરના કામમાં વધારે કે ઘટાડો કરવાની તેમજ અન્ય એક્સ્ટ્રા આઈટમ કરવા તથા ટેન્ડર ની કોઈ આઈટમ જરૂરી જણાયે રદ કરવાની સત્તા ટેન્ડર મંજૂર કરનાર ઓર્થોરીટીની રહેશે જેમાં કોઈ પ્રકારના વળતરની કે હકદાવાની માંગણી કરી શકશે નહીં.
૧૦. નગરપાલિકા કે નગરપાલિકાના કન્સલ્ટન્ટ ધ્વારા કામગીરી દરમ્યાન વખતો વખત જે સૂચનાઓ આપવામાં આવે તેનો ચુસ્તપણે કોન્ટ્રાક્ટર/એજન્સીએ અમલ કરવાનો રહેશે.
૧૧. કામગીરી દરમ્યાન તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર/એજન્સીની રહેશે.
૧૨. નગરપાલિકા ધ્વારા બિલના નાણાં ચૂકવવામાં કોઈ કારણોસર વિલંબ થાય તો કરારલેખ પ્રમાણે કામગીરીમાં એજન્સીનો વાંધો, વિરોધ ચાલશે નહીં.
૧૩. કોઈપણ કાયદાકીય લિટિગેશન માળીયા મિયાણા શહેરની કોર્ટમાં રહેશે.
૧૪. લેબર એક્ટ પ્રમાણે રજીસ્ટ્રેશન અંગે અમલ કરવાનો રહેશે જો તે મુજબ કાર્યવાહી નહીં થઈ હોય તો તે માટે કોન્ટ્રાક્ટર/એજન્સી સંપૂર્ણ પાણે જવાબદાર રહેશે.
૧૫. સેલેક્શન, સરચાર્જ અન્ય ટેક્સ કે અન્ય કોઈપણ સરકારી કરવેરા ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટર/એજન્સીની રહેશે.
૧૬. ચાઈલ્ડ લેબર એમ્પ્લોઈ કરી શકશે નહીં તે માટે કોન્ટ્રાક્ટર/એજન્સી સંપૂર્ણ પાણે જવાબદાર રહેશે.
૧૭. કોઈપણ કારણસર ટેન્ડર રદ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર/એજન્સી તે અંગે કોઈપણ પ્રકારનો હક કે વળતરની માંગણી કરી શકશે નહીં.
૧૮. રાજ્ય/કેન્દ્ર સરકારશ્રીના વખતો વખતના કાયદા મુજબ જે કોઈ રકમની કપાત કરવાના હુકમ સરકારશ્રી કરશે તે મુજબ કોન્ટ્રાક્ટર/એજન્સીના બિલમાંથી કપાત કરવામાં આવશે.
૧૯. લેબર વેલ્ફેર ફંડ માટે હાલમાં રાજ્ય સરકારશ્રીએ કરેલા હુકમ મુજબ બિલમાંથી કાપી લેવામાં આવશે.
૨૦. સ્થળ પરિસ્થિતી/જરૂરિયાત મુજબ કામ કરાવતા કોન્ટ્રાક્ટર/એજન્સી ધ્વારા કોઈપણ પ્રકારની વધારાનીકામગીરી માટે વધારે નાણાંકીય માંગણી કરી શકશે નહીં અને કામ ઓછું થાય તો પણ કોન્ટ્રાક્ટરની વળતરનીમાંગણી સ્વીકારવામાં આવશે નહીં.
૨૧. ચાલુકામ દરમ્યાન પ્રોટેક્શનની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર/એજન્સીની રહેશે અને કોઈપણ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
૨૨. કોઈપણ કારણસર જો કોન્ટ્રાક્ટર/એજન્સીને કામ ન આપી શકાય તો તે અંગે કોન્ટ્રાક્ટર/એજન્સી કોઈ પણપ્રકારનો નુકશાની વળતરનો હક દાવો કરી શકશે નહીં કે કાયદાકીય કાર્યવાહી આ અંગે થઈ શકશે નહીંટેન્ડર મંજૂર થયાનો અર્થ કામ આપીજ દેવાનું છે. તેવો થઈ શકશે નહીં.

૨૩. આ કામનો ડિક્કટ લાયાબીલીટી પીરીયડ ૨ વર્ષ નો રહેશે.

૨૪. ડિક્કટ લાયાબીલીટી (ફ્રી મેઈન્ટેનન્સ) પીરીયડ દરમ્યાન નુકશાન થશે તે એજન્સીએ તેના ખર્ચે અને જોખમે પુરુ રીપેરીંગ કરી (૨) વર્ષ સુધી નિભાવવાની જવાબદારી એજન્સીની રહેશે જે અંગે કોઈ અલગથી ચાર્જ કેરકમ એજન્સીને મળવાપાત્ર રહેશે નહીં.

માળીયા મિયાણા નગરપાલિકા

ખાસ શરતો

૧. કોઈપણ ટેન્ડર મંજૂર કરવા કે ના કરવાનો હક્ક નગરપાલિકા અબાધિત રહેશે.
૨. કોન્ટ્રાક્ટર કામગીરી માટે એજન્સીએ પોતાનો સ્ટાફ રોકવાનો રહેશે, આ સ્ટાફને મહેનતાણું એજન્સી એ ચૂકવવાનું રહેશે. તથા આ કામગીરી માટે રોકાયેલ સ્ટાફ માળીયા મિયાણા નગરપાલિકા ના કર્મચારી ગણાશે નહીં તથા સદર સ્ટાફ ની ઈલેક્ટ્રિકલ સેફ્ટીની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે જો કોઈ પણ સ્ટાફ ની જાનહાની કે અકસ્માત થશે તેની સંપૂર્ણ જવાબદારી એજન્સી ની રહેશે.
૩. ટેન્ડરમાં દર્શાવેલ કામગીરી માટે જરૂરી તથા યોગ્ય લાયકાત ધરાવતા કામદારો ધ્વારા સેવા આપવાની રહેશે જેની સંપૂર્ણ જવાબદારી એજન્સી ની રહેશે. સદર કામગીરી એજન્સી ધ્વારા થતી હોવાથી કામગીરી દરમ્યાનકોઈપણ પ્રકાર ના અકસ્માત કે કામદારો કે નાગરિકોને ઈજા કે જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારીએજન્સીની રહેશે. આ બાબતે નગરપાલિકાની કોઈપણ પ્રકાર ની જવાબદારી રહેશે નહીં.
૪. સદર કામ પહેલા સ્થળની પૂરી તપાસ કરીને વ્યવસ્થા વગેરેની જાણકારી મેળવેલ છે સાર્થક કન્ડીશનને કારણે ઉદભવેલા કોઈપણ દાવાને ધ્યાનમાં લેવામાં નહીં આવે.
૫. કોન્ટ્રાક્ટરે શેડ્યુલ-બી માં ભરેલ ભાવ તમામ રોયલ્ટી, તથા ટેક્ષ ટ્રાન્સપોર્ટ ભાડુ લોડીંગ અનલોડીંગ સ્ટેકીંગ તથા તમામ માલ સમાન અને મજૂરી વગેરે ચાર્જ સાથેનો ભરવાનો રહેશે. તે બાબતે કોઈપણ અલગથી ચાર્જ નગરપાલિકા ધ્વારા આપવામાં આવશે નહીં, તે વિગત જાણીને એજન્સી એ ભાવભરવાના રહેશે.
૬. કામ સારી રીતે ચાલુ રહીને પુરું કરી શકે તે માટે કોન્ટ્રાક્ટરે બધી જાતના પૂરતા સાધનો-યંત્રો તથા ઓજારો વગેરે પોતાના ખર્ચે રાખવા પડશે જે બાબતે ખાસ ધ્યાન આપવું કે નગરપાલિકા તરફથી સાધનો કે વાહનો મળશે નહીં, એજન્સીએ પોતાના ખર્ચે વાહનો સ્કાયવિફ્ટ રાખવાની રહેશે.
૭. એજન્સી ધ્વારા કામમાં ગેરરીતિ કે નિષ્કાળજી દાખવાની કે ચોકસાઈ પૂર્વક કામ ન કરવું તથા નગરપાલિકા જવાબદાર કર્મચારી અધિકારીની સૂચનાઓ નું પાલન ન કરવું કે કામદારો પાસે પાલન ન કરાવું વગેરે કિસ્સામાં નગરપાલિકા ધ્વારા પ્રતિ દિવસ વધુમાં વધુ રૂ. ૧૦૦૦/- સુધીનો દંડ કે પેનલ્ટી એજન્સી ના બિલમાંથી કાપી શકશે. આ અંગે નિર્ણય કરવાની સત્તા નગરપાલિકા ની રહેશે.
૮. આ પ્રકારના કોન્ટ્રાક્ટરને લાગુ પડતાં ઈ.પી.એફ., જી.એસ.ટી. અને અન્ય ટેક્ષ વગેરે તમામ પ્રકારના કાયદા નિયમોની જોગવાઈની જાણકારી મેળવીને જ એજન્સીએ ટેન્ડર ભરેલ છે. કોન્ટ્રાક્ટર બાબતે એજન્સી ને લાગુ પડતાં સરકારશ્રી ના કોઈપણ કાયદો કે નિયમની જોગવાઈઓનો ઉલ્લેખ આ ટેન્ડરમાં ન હોય તે કારણોસર એજન્સી પોતાની જવાબદારી માંથી છટકી નહીં શકે, પાછળથી આ અંગેની કોઈપણ પ્રકારની જવાબદારી નગરપાલિકાની નહીં રહે, એજન્સીની પોતાની રહેશે.
૯. કોન્ટ્રાક્ટરશ્રી ધ્વારા સમયસર કામગીરી નહીં કરવામાં આવે તેવા સંજોગોમાં તથા સદસ્યશ્રી તથા નાગરિકોના કોઈ પણ ફરીયાદ મળશે તો નગરપાલિકા વગર નોટિશ એજન્સી ધ્વારા ભરેલ સિક્યોરિટી ડિપોઝીટ ની રકમનગરપાલિકા ધ્વારા જપ્ત કરવામાં આવશે અને બાકીની મુદત માટે નગરપાલિકા અન્ય એજન્સીને કામ આપી શકશે જે અંગે નગરપાલિકા ચીફ ઓફિસર નો નિર્ણય આખરી રહેશે અને એજન્સીને એ માન્ય રહેશે.
૧૦. સંપૂર્ણ કામગીરી એજન્સી ધ્વારા થતી હોવાથી કામગીરી દરમ્યાન તથા ડિફિક્ટ લાયબીલીટી દરમ્યાન જો અન્ય કોઈ વ્યક્તિનેકેકોઈજીવનેશોર્ટ સર્કિટ કે જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે જેમાં નગરપાલિકા ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.
૧૧. ખોદાણ કરતાં સમય જો ઈન્ટરલોક તથા સી.સી. કે ટાઈલ્સ આવે તો તેને તેજ સ્થિતિમાં ફરી કરી દેવાનું રહેશે. ઉપરોક્ત તમામ શરતો તથા નિયમો એમોએ ટેન્ડર ભરતા પહેલા કાળજી પૂર્વક વાંચ્યા છે અને એમોને તેમજ અમારા વહીવટ કર્તાઓને કબુલ મંજૂર અને બંધનકર્તા છે તેમજ રહેશે.

કોન્ટ્રાક્ટર/એજન્સીની સહી

ચીફ ઓફિસર,
માળીયા મિયાણા

MALIYA MIYANA NAGARPALIKA

DIST. MORBI

ANNEXURE "A":

QUALIFICATION CRITERIA

Bidders are required to upload scan copies of following applicable documents online through website and also submit hard copy of same during physical submission of tender.

1. The bidder must produce 3A certificate of the similar projects in last 3 year

Note: 3A Certificate valid only bidder must have Government Work/ Semi

Government Work/Local Self Government body only

2. The average annual financial turnover during the last 3 years, ending 31st March of previous financial year, should be at least 50% of the estimated cost put to tender.
3. The bidders shall have R&B (Elec.) contractor registration CLASS E-2 OR ABOVE CLASS certificate. The bidder is required to submit the evidence of the same
4. Copy of the registration of the constitution of bidder firm-i.e.registration of firm as a partnership firm/shop Establishment act /R.O.C registration under company Act, Trust,HUF etc.,whichever is applicable.
5. EPF registration certificate
6. Copy of PAN No.
7. GST registration certificate
8. Bank solvency (Minimum 20% tender amount)
9. I.T. Return of Last three years
10. Tender fees and EMD
11. Agency should submit an Affidavit (Rs.300 stamp paper) stating that they are not blacklisted in any other government department(Current Year)
12. Company's Product Literature showing product range, Capacity, technical details STREETLIGHT R&B CATT 3 CERTIFICATE (LATEST)
13. The offered LED streetlight luminaries must have passed LM 79 and IP65; it is compulsory to attach these reports.

14. Luminary's manufacturer shall have to submit LM 80 test certificates from the LED Manufacturer for the LEDs used in the luminary. (Latest Testing Report).
 15. All documents must be notarized and provided with bid
 16. List of work completed by bidder in past, list of plant and machinery owned by bidder, declaration of work on hand with bidder must be provided.
 17. Company's Product Literature showing product range, Capacity, technical details
- STREETLIGHT R&B CATT 3 CERTIFICATE

CHIEF OFFICER
MALIYA MIYANA NAGARPALIKA

**MALIYA MIYANA NAGARPALIKA -
DIST :- MORBI**

SCHEME :- વિવેકાધીન ગ્રાન્ટ વર્ષ ૨૦૨૬-૨૦૨૭

SCHEDULE – ABSTRACT

Description	Estimated Cost	Tender Cost
SCHEDULE-"B1"		
Supplying & Erecting Street Light Pole From Different Location For Maliya Miyana Nagarpalika.	12,58,343.00	
Total	12,58,343.00	

I/We am/are willing to carry out the work at _____% above/below percent (should be written in figures and words) of the tendered amount mentioned above.

Tendered amount put to tender Rs. 12,58,343.00

Add.: _____% above Rs. _____

NetRs. _____

In words _____

Tendered amount put to tender Rs. 12,58,343.00

Deduct.: _____% below Rs. _____

NetRs. _____

In words _____

Signature of Contractor.

**Chief Officer,
Maliya Miyana Nagarpalika
Maliya Miyana**